

વર્ષ-૧૦, અંક-૧૦, સંવત ૨૦૭૧ કારતક સુદ-૪,  
પ્રસિધ્ય તા. ૨૭-૧૦-૨૦૧૪, સોમવાર  
છુટક નકલ રૂ. ૫-૦૦, વાર્ષિક લવાજમ રૂ. ૬૦-૦૦

Chetavni (GUJ) RNI No. GUJ GUJ / 2005 / 16095  
Postal Regd. No. GAMC-1507/2012-2014 Valid up 31-Dec-2014  
Posted at Ah'd PSO On 27th of Every Month

## જ્યોતિર્માલા



યચ્છુશ્રૂષયા સુશિષ્યાણાં ચિતમાશુ વિશુદ્ધયતિ ।

યલ્કૃપાલેશમાગેણ જનો જ્ઞાનં ચ વિનંતિ ॥

યત્સેવનાર્થ શિષ્યાણામષ્પાશવિલેદનમ् ।

જયતે લભ્યતે મોક્ષસ્તસ્મૈ વ્યાસાય મે નમઃ ॥

જેઓની શુશ્રૂષા કર્યાથી સારા શિષ્યોના ચિતની વિશુદ્ધિ થાય છે, જેમની થોડી કૃપાથી (પણ) માનવ જ્ઞાન પ્રાપ્ત કરે છે, જેમના સેવનથી શિષ્યોના આઠ પાશ (ધૂળા, લજ્જા, ભય, શંકા, નિંદા, કુલાભિમાન, પ્રકૃતિસ્વભાવ અને જતિઅભિમાન) છૂટી જાય છે અને મોક્ષ પ્રાપ્ત થાય છે, તેવા (સદ્ગુરુ વલ્લભ) વ્યાસને વંદન હો.

પૂર્વિવતારપ્રવાર્ય સામ્રાતાં

સત્યકાર્યદક્ષઃ કુલદીપકશ્ચ ।

યઃ સદ્ગુણાનાં નિધિરેષ ભવ્યઃ

જેચાન્મહાનત્ર રમૂજિલાલઃ ॥

પૂર્વના અવતારોના પ્રભાવને લીધે બધાં સત્કાર્યોના વિશારદ, કુલદીપક અને સદ્ગુણોના ભંડારરૂપ એવા ભવ્ય અને મહાન ગુરુદેવ રમુજીલાલનો જ્યોતિર્માલા.

(ગતાંગથી ચાલુ...)

(૧) વિચાર એ તત્ત્વચિંતન શાત્રનો વિષય હોઈ એથી ‘સમ્યગ્જ્ઞાન’ પ્રાપ્ત થાય છે. પણ તે જ્ઞાન ધર્મવિના અપરોક્ષ અનુભવ કરાવી શકતું નથી.

(૨) ધર્મ માત્ર કિયારુપ નથી, તેથી કર્તવ્ય કરવામાં જ એની પરિપૂર્ણતા નથી. કર્તવ્ય કરવાથી નિષ્પાપ થવાય છે, પવિત્રપણું આવે છે, પરંતુ જ્યાં સુધી જ્ઞાનોદય થતો નથી ત્યાં સુધી આત્મવિવેક કે બ્રહ્મવિવેક આવતો નથી. તેથી આત્મા એક પ્રકારની જડતા અનુભવે છે અને સર્વ કર્મ બ્રહ્મપર્ણ કરી નિષ્પાપ થઈને મોક્ષપ્રાપ્તિનો પુરુષાર્થ સિદ્ધ કરવાનો પરમોદેશ સિદ્ધ થતો નથી.

(૩) વિચાર અને આચાર, જ્યાં સુધી તેમાં આનંદનો અનુભવ ન થાય ત્યાં સુધી મનુષ્યને પરમસાધ્ય તરફ દોરવવા અસમર્થ છે. જ્યારે જ્ઞાન મેળવી તદ્દનુસાર કિયા કરી જ્ઞાન અને કિયા (ધ્યાન) બન્નેમાં આનંદ અનુભવાય ત્યાર દેહાદિ ભાન વિસ્મૃત થઈ પરમાનંદના પ્રેમમાં નિમગ્ન થવાતાં ધર્મનું ગ્રયોજન સિદ્ધ થાય છે.

દરેક મનુષ્યે પોતાના જ્ઞાન, શક્તિ અનુસાર અમુક કર્તવ્ય કરવા આત્મા બંધાયો છે, તે કર્તવ્ય સિદ્ધાંત જાણ્યા છતાં કર્તવ્ય કાર્ય થાય નહિ ત્યાં સુધી જ્ઞાનની સાર્થક્યતા અને આત્માની શાંતિ થતી નથી. કર્તવ્ય જ્ઞાન મેળવીને તદ્દનુસાર કાર્ય કરવામાં પણ જ્યાં સુધી અનિષ્ટા કે બેદ કે અન્ય વિઘ્નો જાણાય છે અને તે કાર્યમાં આનંદ આવતો નથી ત્યાં સુધી તે આત્માની કર્તવ્ય-ભાવના અપૂર્ણ રહે છે અને ત્યાં સુધી તે જન્મ મૃત્યુથી તરી પરમશાંતિ પ્રાપ્ત કરી શકતો નથી.

વસ્તુનું યથાર્થ સ્વરૂપ શું છે ? વિચારવાનું કામખૂદર્શનાદિ વિચાર ગ્રંથોનું છે. સારા ખોટાનો એટલે કાર્યકાર્યનો ઉપદેશ કરવાનું કામ વિધિનિષેધ શાસ્ત્રનું જેને “ધર્મશાસ્ત્ર” કહેવાય છે તેનું છે અને રમણિયાર્થ ધોતનનું કાર્ય, સાહિત્ય અને સંગીતાદિ કલાઓનું છે. તત્ત્વશાસ્ત્ર યાને ન્યાયશાસ્ત્ર પ્રમાણદ્વારા વસ્તુ સ્વભાવનો નિર્ણય કરે છે. વિધિનિષેધ શાસ્ત્ર પ્રવૃત્તિ-નિવૃત્તિનો ઉપદેશ કરે છે. કવ્યાદિ સાહિત્ય ગ્રંથો ઈતિહાસ પુરાણાદિ વસ્તુનું ધોતન કરી તથા ધર્મવૃત્તિમાં ચૈતન્ય અપી આનંદ અનુભવાવે છે. આ સર્વ ઉદ્દેશોનો સંગ્રહ ધર્મમાં થાય છે, અને આ ત્રણ અંગો સ્કુટ વા અસ્કુટર્પે સર્વ ધર્મોમાં રહેલા છે. પરંતુ બ્રાહ્મધર્મમાં સર્વ અંગો સારી રીતે વિકસિત થયેલાં છે. એટલું જ નહિ પણ વેદના સમયથી અદ્યાપિ પર્યત જે ગ્રંથોમાં એ અંગોનું વધુ સ્ફોટન છે. તે સર્વને ધર્મગ્રંથ તરીકે માન આપવામાં આવે છે. બ્રાહ્મધર્મના અનુસરનારાઓ આદિગ્રંથ તરીકે વેદને માને છે તો પણ વેદનેજ વળગી ન રહેતાં “ગુણાઃ પૂજા સ્થાનમ्” એ સિદ્ધાંત સ્વીકારી ધર્મવૃત્તિ જાગૃત રાખનાર સર્વ ગ્રંથોને યોગ્ય માન આપેલ છે અને જુનામાં જુના ગ્રંથ વેદની મહત્ત્વાની કામય રાખી છે.

સંસારમાં અનેકને પોતાનો આત્મા દુઃખ, મહિનતા અને પાપ વગેરે અનેક અનિષ્ટ પદાર્થોથી ભરેલો જણાય છે. અને તે જ રીતે વિશ્વમાં પણ પરસ્પર દેવી અને આસુરી શક્તિઓનો કલહ મચી રહેલો દેખાય છે. એ સર્વ વિષમતાને ટાળવા તથા ખુલાસો કરવા એનું અંત:કરણ મથે છે, તે સમયે તેને ધર્મજ્ઞાનના પ્રકાશની જરૂર પડે છે. તે જ્ઞાનનો પ્રકાશ પ્રાપ્ત થતાં જ વિશ્વ જુદે રૂપે ભાસવા માંડે છે અને દુઃખ, સુખરૂપ થઈ જાય છે. મહિનતા જતી રહી પવિત્રતા છાયી જાય છે. પાપપટ દૂર થઈ પુણ્યપ્રવાહના મોજાં ઉછાળા મારે છે અને જગતમાં વિરોધ કે જરૂર જેવું કાંઈજ દેખાતું નથી; પૂર્વનો અનુભવ અને આ નવીન અનુભવ એ બે સમાન કક્ષાના માત્ર કાલી પૂર્વપર એક પછી એક ક્રમવાળા ને લાગતાં એક અનુભવ બીજા અનુભવનો બાધક જણાય છે. અર્થાત્ પૂર્વનો અનુભવ બીજા અનુભવનો બાધક જણાય છે, અર્થાત્ પૂર્વનો અનુભવ ખોટો અને હાલનો અનુભવ સત્ય પ્રતિત થાય છે. વેદાંત વગેરેમાં આથી “જ્ઞાનાન્મોક્ષः” જ્ઞાન વડે મોક્ષ છે એમ વારંવાર ઉદ્ઘોષ સંભળાય છે, તેથી “અતે જ્ઞાનાન્ મુક્તિઃ” જ્ઞાન વિના માયાના બંધનથી મુક્તિ થતી નથી, એમ શુંતિ કહે છે.

દરેક મનુષ્યના હૃદયમાં કર્તવ્યની અમુક ભાવનાઓ હોય છે, પણ બહુ તીવ્ર પ્રતિભા વિના એ ભાવનાઓ જોઈએ તેવી માનવહૃદય આગળ આલેખાતી નથી, કદાચ આલેખાય તો પણ અન્યજન આગળ તે ઉપસ્થિત કરી આપવાની શક્તિ સાધારણ મનુષ્યોમાં હોતી નથી, પરંતુ એ સર્વ સામગ્રી, ભાવના અને કર્તવ્ય તથા સમજાવવાની શક્તિ અને સદ્ગ્યારિન્ય જેનામાં હોય છે તે પોતાના જીવનમાં દાખલાથી, ઉપદેશથી, જ્ઞાનથી અથવા તે સર્વથી અન્યજનોને અનુભવાવી શકે છે. અને તે ધર્મપ્રવર્તક યા ધર્મરૂપ તરીકે જગતમાં પૂજાય છે.

બ્રાહ્યધર્મે રૂચક વચનોનો આશ્રયકર્યો નથી તથા સદ્ગુરુ પાસે સમજવા ન જનારને જ્ઞાન અર્પવાનો અગર પોતાનો ધર્મ વધુ પ્રતિષ્ઠ કરવાનો કોઈ પ્રયત્ન કર્યો નથી, કેમકે તેમને માન-પૂજાની અને કીર્તિ મેળવવાની આકંક્ષા હોતી નથી. આવા મહાત્માઓ જગતમાં વિરલ સ્થળે અને વિરલ કાળે જગદોદ્ધાર માટે ઉત્પન્ન થાય છે. માટે તેમની ખોટ પૂરી પાડવાની જરૂર રહે છે અને તે ખોટ તેમણે પ્રવત્તિવિલાં તેમના આત્માની બાધ્ય મૂર્તિરૂપ ધર્મથી પૂરી પડે છે. જે બ્રાહ્યધર્મે તેનાં મહાભારત, રામાયણ અને ભાગવતાદિ ગ્રંથોદ્ધારા રામ, સીતા, દમયંતી, સાવિત્રી, યુધિષ્ઠિર, ધ્રુવ, પ્રહલાદ, હનુમાન, હરિશચંદ્ર વગેરે અનેકાનેક કર્તવ્યભાવનાના આદર્શભૂત ધર્મવીર શ્રી-પુરુષના પાત્રો દ્વારા પૂરી પાડી છે, તે અન્ય ધર્મોના ગ્રંથોમાં ભાગ્યેજ જણાશે.

---○---

**શિષ્ય :** પ્રવૃત્તિલક્ષણ અને નિવૃત્તિલક્ષણ ધર્મ ક્યો? આ બેથી કોઈ ઉત્તમધર્મ છે કે, તે જાણાવો.

**ગુરુદેવ :** પ્રવૃત્તિ લક્ષણ ધર્મ એ છે કે જે ધર્મકર્મના રહસ્યો સમજવા જતાં જિંદગીના અંત સુધી ઉપાધિઓમાં નિમગ્ન રહે છે અગર ધર્મ ફેલાવવાની આ જગતમાં પોતાની ધર્મમાન્યતા શ્રેષ્ઠ ગણાવવાની યા ધર્મનો વિજય કદરવાની તથા ઉપદેશ કરવામાં રચ્યામચ્યા રહેવાની, એવી તેવી આકાંક્ષાઓમાં જીવન ગુજરાયે છે. પણ તે કાર્યો કર્યા બાદ જે વૃદ્ધાવસ્થામાં નિવૃત્તિ મેળવતો નથી તે “પ્રવૃત્તિલક્ષણ ધર્મ” છે.

નિવૃત્તિલક્ષણ ધર્મ એ છે કે :- જે પ્રભુભક્તિ કરીને ઈશ્વરના વિશ્વાસે બેસી રહે છે અને કાંઈપણ ધાર્મિક પ્રવૃત્તિ નથી કરતો તે “નિવૃત્તિલક્ષણ ધર્મ” છે. અર્થાત્ પ્રભુભક્તિ અને ધર્મકર્મ કરતો હોવા છતાં ધાર્મિક ઉપદેશ અને ધર્મસેવામાં પ્રવૃત્તિ નથી કરતો, તે નિવૃત્તિલક્ષણ ગણાય છે. પરંતુ ખરી રીતે નિવૃત્તિપરાયણ ધર્મ એટલે આપણસથી ઘેરાયેલો અને આત્માઓના હિતકર્તાના હોવાથી તે શ્રેષ્ઠ નથી. તેમજ પ્રવૃત્તિપરાયણ ધર્મ પરાયાને ઉપદેશ દેવામાં અને ધર્મસેવામાં જીવન ગુજરાવાથી પોતાને અને પોતાના આત્માને ઉત્તમ શાંતિ આપવાનો અને આત્માને પ્રભુમાં નિમગ્ન બનાવવાનો લાભ બાકીજ રહી જાય છે.

માટે તે બન્ને કરતાં ઉત્તમ ધર્મ તો એ છે કે :- પ્રથમથી અંત સુધી ધર્મજિજ્ઞાસુઓને માટે અને કલ્યાણ ઈશ્વરનારાઓને માટે સર્વદા ધર્મોપદેશ કરવો. છતાં તેમાં એવા અંધન બનવું કે જેથી પોતાનું આત્મ કર્તવ્ય રહી જાય. માટે બની શકે તો અમુક ઉંમર સુધી પ્રવૃત્તિધર્મનો સ્વીકાર કરવો અને તેમાં આત્માનું હિત પણ પુરુ કરી લેવું અને વૃદ્ધાવસ્થામાં મગજની અશક્તિને લીધે આંતરિક સંન્યસ્ત યાને આત્મસંન્યસ્ત પાળી પરમાત્મામાં આત્માને સમર્પણ કરી દેવો અને ખાસ જિજ્ઞાસુઓ પુરતો ઉપદેશ કરવો, એ ઉત્તમ, સર્વोત્કૃષ્ટ અને પરમકલ્યાણનો માર્ગ છે.

જેટલો જ્ઞાનોપદેશ અન્ય આત્માઓ આપી શકે છે, તેના કરતાં જ્ઞાનયોગી આત્મા વર્ષોનો ઉપદેશ અલ્ય સમયમાં એટલે એક અગર બે સપ્તાહમાં આપી શકે છે. તેજ આવો ઉત્તમાર્ગ સ્વીકારી પોતાના જીવનમાં ઉતારી શકે છે અને તેમાં પણ પૂર્વનો પરમ સંસ્કારી હોય તેજ નિરહંકાર અને કીર્તિની વાસનારહિત રહી શકે છે. તે સત્ય મોક્ષાચ્છુઓ માટે સર્વ કાર્યો કરવા તત્પર અને ધર્મતથા જ્ઞાન, ધ્યાનની અપેક્ષા રહિત જીવો માટે નિવૃત્તિમય જીવન ગાળી શકે છે. તેવા આત્માઓને પૂર્વના ભ્રષ્ટ યોગીઓ અત્યંત ચાહે છે. વળી તેવા આત્માઓ દરેકને ઉપદેશ દેવા ચાહતા નથી તથા મોક્ષાકાંક્ષીને ઉપદેશ દેતાં અચકાતા કે

ઉપદેશજ્ઞાનમાં કચાશ રાખતા નથી અને તેજ પ્રમાણે જ્ઞાનમાં, યોગમાં અને આત્મબળમાં પણ પોતાનું ઊંચ જીવન પુરુ કરે છે.

---○---

૧૨

**શિષ્ય :** શું બ્રાહ્યર્મ બીજા ધર્મો કરતાં વધારે આત્મબળ ધર્મજિજ્ઞાસુઓને આપી શકે છે? શું હિન્દુ ધર્મ માં બીજા ધર્મ કરતાં વધુમાં વધુ પરમશાંતિ સમાયેલી છે?

**ગુરુદેવ :** જ્ઞાન મળ્યા છતાં તેમજ કર્તવ્યની ભાવના તીવ્ર ઉપસ્થિત થયા છતાં પણ કેટલીક વખત એ ભાવનાને અનુસરવાની અને મૂર્ત સ્વરૂપ આપવાની આપણામાં શક્તિ નથી એમાપણું અંતર તપાસતા લાગે છે. આવા વખતે બ્રાહ્યર્મ કોઈ અદ્ભુત, અપ્રતિમ આત્મબળ આપી શકે છે કે જેમાં ઈશ્વરીય કૃપાનો અમીમય વરસાદ વરસતો હોય છે. “આ કલ્પના નથી પણ અનુભવપૂર્વકની માન્યતા છે.”

આ સૂચિથી પર એવી દુનિયાને જેઓ માનતા નથી તેઓને પૂર્વજન્મની ઘટનાદ્વારા વિશ્વનું રહસ્ય સમજાવીને સ્વર્ગ, નરકાદિ વ્યવસ્થાથી સત્કાર્યમાં પ્રવર્તવાનો જેમને અધિકાર છે, તેઓને તેવી રીતે અને ઉત્તમાધિકારીઓને ઉત્તમજ્ઞાનયુક્ત સર્વાત્મભાવની ભાવના બતાવીને સર્વને યથાયોગ્ય બ્રાહ્યર્મ સત્કાર્યમાં પ્રેરે છે અને તે તરફ પ્રવર્તવા અને આગળ વધવા માટે ભગવાનના અવતારો અને સંતોરૂપી અખૂટ ભંડારમાંથી આત્મબળ અર્પે છે. “આવું આત્મબળ કિશ્ચિઅન ધર્મજ આપી શકે છે, એ વાત પર કિશ્ચિઅન પાદરીઓ ખાસ ભાર મૂકે છે.” પરંતુ યથાર્થ રીતે તપાસતાં જણાશે કે :- એ ધર્મમાં મનુષ્ય આગળ જે પ્રવર્તક હેતું મૂકવામાં આવે છે તે આપણા બ્રાહ્યર્મ જેવો અને જેટલો ઊંચ, વ્યાપક અને સબળ નથી, તેમાંની કર્તવ્ય ભાવનાનું સિદ્ધાંત જીવન પણ એકદેશી અને અપૂર્ણ છે.

આપણી ભગવદ્ ગીતાની સમાન કોટીમાં મૂકાતું જીસસનું “સર્મન ઓફ ધી માઉન્ટ” જોતા જણાશે કે :- એમાં અમુક કાર્ય અમુક રીતે કરવાનો ઉપદેશ કર્યો છે અને તેમાં પ્રવર્તક હેતુ એ બતાવ્યો છે કે :- “Great is your reward in Heaven” એમ કરવાથી સ્વર્ગમાં તમને મોટો બદલો મળશે. આ હેતુ નિર્જવ નથી તેમ ઉત્તમ કર્તવ્ય ભાવનાને શોભે તેવો નથી, એ સ્પષ્ટ છે.

કિશ્ચિયેનિટી આત્મબળના પ્રવાહાર્થે આપણી તથા ઈસ્લામ અને જૈન ધર્મની માફક અવતારનો સિદ્ધાંત સ્વીકારે છે. પરંતુ આ બાબત વિચાર કરતાં જણાશે કે :- મનુષ્યે જે કર્તવ્યભાવના સિદ્ધ કરવાની છે તે એકજ પુરુષમાં સંપૂર્ણપણે મળવી અશક્ય છે. એક ગુણ એક વ્યક્તિમાંથી, તો બીજો બીજામાંથી લેવો પડે છે, તે અનાદિ નિયમ છે. પરંતુ દરેક

યુગના જમાનામાં કર્તવ્ય જુદા જુદા ઉત્પન્ન થાય છે. તદનુસાર જુદી જુદી કર્તવ્યભાવનાઓની જરૂર પડે છે. માટે અમુક દેશમાં ઉત્પન્ન થયેલ અમુક એકજ પુરુષમાં જ તમામ સદ્ગુણો, આદર્શો, જ્ઞાન, શક્તિ વિગેરેની પરિપૂર્ણતા થવી તદન અશક્ય છે.

કોઈ પણ ધર્મ ખોટો અગર તિરસ્કાર કરવા યોગ્ય છે, એમપણ નથી. અનેક દ્રષ્ટિબિંદુથી અવલોકતાં બ્રાહ્યધર્મની સર્વોત્તમતા પ્રત્યક્ષ છે. વર્તમાન સમયમાં આપણી ધાર્મિક સ્થિતિ અભિમાન કરવા લાયક રહી નથી અને જ્યાં સુધી કાયરતાનો ત્યાગ કરી ધર્મનેજ જીવનનું રહસ્ય સમજી તેની સર્વ પ્રકારે રક્ષા કરવા પ્રયત્ન નહી કરીએ ત્યાં સુધી વધુ બગડતી જશે અને “તે વધુ બગડે તે પહેલાં ઊઠો, જાગો અને કાર્ય કરો.”

ગમે તે પ્રયત્નો થશે તો પણ સદ્ગર્ભનો નાશ કોઈ કાળે થનારજ નથી, કેમકે આપણા હિન્દુધર્મમાં બીજા ધર્મ કરતાં વધુમાં વધુ પરમશાંતિ સમાયેલી છે.

---○---

૧૩

**શિષ્ય :** ધર્મ પાળેલો ક્યારે કહેવાય, તે કહો.

**ગુરુદેવ :** ગ્રંથોના અભ્યાસથી ધર્મ પ્રાપ્ત થતો નથી, ધર્મના વાદવિવાદ કરતાં આવડ્યા તેથી ધર્મ પ્રાપ્ત થતો નથી, ધર્મમાં પેસી ગુરુ તથા ભક્તો તરફથી મોટા બની માન્ય ઈલ્કાબો મેળવ્યાથી ધર્મ પ્રાપ્ત થતો નથી, હજારો ટીલાં ટીપકાં કરી માળાઓ પહેરી માળાઓ હાથમાં લઈ રામરામકરતાં ફરવાથી ધર્મ પ્રાપ્ત થતો નથી; પરંતુ શાસ્ત્રાદિ શ્રવણ, સત્યાસત્યનો વિચાર, તત્ત્વદર્શી આત્માઓનો સમાગમઅને બ્રહ્મનિષ સદ્ગુરુની સાન અથવા ગુરુગમ, આ સર્વ ધર્મ પ્રાપ્ત કરવામાં સહાય કરનાર આત્મિક કર્મના ટેકા છે, તથા ધર્મ પ્રતિબિંબ દરેક આત્મામાં તત્ત્વરૂપે અદ્રશ્ય વશી રહેલું છે તથા જ્યારે આત્માને મુળ બ્રહ્મનું ભાન થઈ વિજ્ઞાનનો પ્રકાશ થતો જાય ત્યારે જ ધર્મના માર્ગનો પ્રવેશ તરીકે કાંઈક અનુભવ કરી શકાય છે. તથાપિ ધર્મનો સાક્ષાત્ અનુભવ તો પ્રત્યેક આત્મા સ્વાત્માશ્રયી બની સત્કર્મ કરી આત્મબળ વડે જ કરી શકે છે, તેથી કહ્યું છે કે :- “નાસ્તિ યાત્મસમં બલમ્” પોતાના આત્મબળ સમાન બીજું કોઈ પણ બળવાન નથી. કેમકે આત્મબળ સર્વોત્કૃષ્ટ બળ છે કે જેથી તન-મનમાં વિષય, વિકાર તથા દુર્ગુણો નાશ પામે છે, અને સદ્ગુણો પ્રવેશી ધર્મદ્રઢતા તથા આત્મા અને પરમાત્મા પર સંપૂર્ણ વિશ્વાસ પ્રગટી આત્મા દેહના બંધનમાં હોવા છતાં, તન મનથી લેપાયમાન હોવા છતાં નિર્વીપ બની શરીર, મન વિગેરે સર્વને પોતાને વશ બનાવી જીવન્મુક્ત બની રહે છે, અને સર્વપ્રકારે મન ઉપર કાખુ ધરાવવાથી ઇચ્છિત કાર્ય સહેલાઈથી કરી શકે છે. કદાચ અનેક વિધો આવે છે તો પણ આત્મબળવાળા

આત્માઓ તન, મન અને આત્માને દુઃખ રહિત બનાવી અખંડ સુખનું ભાન કરાવે છે. અર્થાત્ જે અલભ્ય આનંદ લઈ રહેલો છે, તેને માયાના ક્ષણિક દુઃખો હિસાબમાં રહેતાં નથી. ગમે તેવો તત્ત્વવેત્તા હોય, અથવા ગમે તેવો સભાજીત વાક્યાતુર્યવાન હોય અથવા ચહાય તેવો દ્રઢ ભાવનાવાન મનુષ્ય હોય પરંતુ જ્યાં સુધી તે મિથ્યા મતરહિત બની, પોતે પોતાની મેળેજ આત્મનિરૂપણ કરતો નથી, ત્યાં સુધી હું તેને “ધર્મ” નામ આપી શકતો નથી.

આપણા ચક્ષુઓ કાંઈ પીઠ પર નથી; તે તો આપણા મુખ પર છે, તેમજ સામેની દિશામાં છે, તેથી સત્યદર્શી બની આગળ વધો અને જે ધર્મને તમે તમારો પોતાનો ધર્મ કહી ગર્વ કરતા હો, તે ધર્મમાં કહેલાં સત્ય ઉપદેશો પ્રમાણે વર્તવા માંડો. ધર્મોપદેશને કિયામાણમાં મૂકો, ધર્મ વિતંડાવાદમાં જીવન ગુમાવો નહિ તથા પરાઈ ભૂલો ખોળવા કરતાં પોતાની જ ભૂલો ખોળો. વિચારો કે આ નિર્લજ્જ આત્માએ હજારો વિકાર ભરેલા ક્ષણિક સુખો ભોગવ્યાં અને તેનો પૂરો અનુભવ થતાં તે સુખોથી દશ ગણા દુઃખો જોયા છે. થોડો સમય સર્વ પ્રકારે સુખ દીકું; તો તેથી સો ગણું સર્વ બાજુથી દુઃખ જોઈ આવતું હૃદય બળી રહેલ છે, નિસાસા નાંખી આત્મા અંતરમાં રડી રહેલ છે, તો પણ સંસારના મોહનો દુઃખ આવવાથી તુટી રહેલ ફાંસો, ગળામાંથી કાઢી બચી જવાનું મન થતું નથી; સંસારના કડવા અનુભવ લીધા છતાં દુઃખ સમયે સુખની વધારે આશા થતી જાય છે, કે મને અમુક કાર્યમાં ફર્તેહ મળશે અને સુખી થઈશ, આમ વિચારો કરી પ્રભુ તરફ લક્ષ્ય ન આપતાં જીવાત્મા માયાના બંધનમાં વધારે બંધાતો જાય છે અને “હાર્યો જુગારી બમણું રમે” તે પ્રમાણે આંખો મીંચી સંસારસુખ લેવા રાત્રિ-દિવસ સતત પ્રયાસ કરી રહે છે, પરંતુ હોય છે તેવો ને તેવો જ રહે છે અને કાંઈ સુખ મળતું નથી. ભવોભવ પંચવિષયની મોજમજા કરવા છતાં તથા આ જન્મમાં, પણ એ વિષયો ભોગવ્યા છતાં અભાવી આત્મા દુષ્કર્મનો પંથ પકડી અનેક પ્રકારે દુઃખી થવા છતાં પાપના માર્ગ ચાલતાં કંટાળતો નથી. તન, મન અને ત્રિયાથી થનથન થઈ ગર્વમાં ઘૂમી રહેલ આત્માઓ, કથા વાતાઓમાં દોડધામ કરી ધાર્મિકતા બતાવે છે. કદાચ સત્ય હૃદયથી શ્રવણ કરતા હોય તો પણ શું? શાધી કે કેવળ ધર્મોપદેશ સાંભળ્યા કરવાથી શો લાભ? ઉપદેશોની વાતો કરવાથી શો લાભ? ઉપદેશોનો સંગ્રહ કરવાથી શો લાભ? સત્ય રીતે તો ઉપદેશનાં વચ્ચનો પાણી તે પ્રમાણે વર્તી પવિત્ર જીવન ગાળવામાંજ લાભ સમાયેલો છે. કારણ કે જગતમાં “કહેવું સહેલું છે પણ કરવું મુશ્કેલ છે” તે અનુસાર કંઈ મહાત્માઓ અને ભક્તો થઈ ગયા છે અને થયે જાય છે. પરંતુ તેમાં કહેનારા કરતાં કર્મ કરનારા અને નિષ્કલંકિત પવિત્ર જીવન ગાળનાર ચારિત્ર્યવાન કોઈકજ હોય છે. ચારિત્ર્યહીન જ્ઞાનવાન

કરતાં જ્ઞાનહીન ચારિત્ર્યવાન શ્રેષ્ઠ છે. માટે ચારિત્ર્યવાન થઈ જ્ઞાનવાન થવું અને જ્ઞાનવાન થઈ ધર્મવાન થવું. જેથી આત્મબળ પ્રાપ્ત કરી શકાય. કેમકે ઉત્તમમનુષ્ય અવતાર અને તેમાં વળી આત્મા-પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત થઈ આત્મકલ્યાણનું કર્મ કરવાનાં સાધનો ફરી ફરી મળનાર નથી.

જેમ “ધોખીનો કુતરો નહિ ઘરનો કે નહિ ઘાટનો” તે પ્રમાણે નહિ રહો પ્રભુભક્તિમાં કે નહિ રહો માયિક કર્મમાં; એમ થવાથી માયા પણ મેળવી શકશો નહિ અને પ્રભુને પણ મેળવી શકશો નહિ; એમ અધવચ રહેશો. શાથી કે માયા મેળવવા પ્રયાસ કર્યો પણ પૈસાદાર થઈ શક્યા નહિ અને જેઓ પૈસાદાર થયા તેઓ મરતી વખતે પોતાની સાથે એક પાઈ પણ લઈ જઈ શક્યા નહિ. તો તે માયા મેળવેલી નિરર્થક છે, એમ સમજ કોઈ કોઈ મનુષ્યો પ્રભુને મેળવવા માયિક કર્મો છોડીને ધર્મકર્મ કરવા સાવધ થાય છે, પરંતુ માયાની કસોટીમાં પાર ઉતરી, પોતાની આત્મિક ભાવના પાર પાડી શકતા નથી; તો તેવા ધર્મકર્મમાં અધવચ ડેલાં ખાનાર મનુષ્યોને લાખોવાર ધિક્કાર છે. શાથી કે જેટલો વખત પ્રભુભજન કરવાના કામમાં ગાય્યો અને નાહક હેરાન થયા તેના કરાતં જો તેટલો વખત માયિક કામમાં ગાય્યો હોત તો નશ્વર પદાર્થોનો પણ થોડા ટાઈમપૂરતો કાંઈક સુખવૈભવ લઈ શકત, તે પણ ગુમાય્યો. એટલે કે “ન મેળવી માયાને અને ન મેળવ્યા પ્રભુને.” આવા મનુષ્યો બે બાજુથી લટકી લક્ષ્યોરાસીમાં ભટકતા રહે છે.

માટે જો ધર્મકર્મ કરવા ચાહતા હો તો એક નિશ્ચયથી, દ્રઢ અને પવિત્ર ભાવનાથી, સંપૂર્ણ શ્રદ્ધાથી, સ્વાત્મસિદ્ધાંત પાર પાડવા માટે અલૌકિક અદ્ભુત જ્ઞાનધ્યાનનો સન્માર્ગ પકડવાની જરૂર છે. અને તે માર્ગ પકડી આત્મકલ્યાણ જેટલું પુરેપુરે સત્કર્મ કરી, પ્રભુકૃપા તથા ગુરુકૃપા મેળવી દિનપ્રતિદિન ધર્મશ્રદ્ધામાં આગળ વધવું જોઈએ. પરંતુ તેમથતું નથી અને માયિક વિધ્યો નહે છે, કારણ કે સર્વને માયાનો અથાગ પ્રેમલાગી રહ્યો છે, તેકોઈ કાળે છૂટે તેમનથી. તેથી જ વારંવાર ધર્મપરાયણ બની પાછા પડે છે. તે વિષે કહ્યું છે કે :-

### દોહરો

માયા કેરા મહા મોહમાં, સર્વે જીવો લપટાઈ રહ્યા;  
કર્મ-ધર્મ ભૂલીનો, સ્નોહ સાંકળે જકડાઈ ગયા.  
ચૂક્યા આત્મિક કર્મનો, કુકર્મના ભોગી થયા;  
થાક્યા જ્યારે કુકર્મથી, ત્યારેજ સૌ યોગી થયા.  
વિષય વૈભવ સુખ મળતાં, ધર્મ કર્મ ગમતાં નથી;  
ધર્મ ચઢી પાપમાર્ગ ચાલે, તેના પાપ સમતાં નથી.

આ જગતમાં બહુ માનવી, ધર્મ પ્રેમથી ડગતાં જતાં;  
 પાપ તેના પ્રગટ થાતાં, હતા ન હતા થઈ જતાં.  
 માયા કળિ પોતાના વચનો, સિદ્ધ કરીને બતાવતા;  
 તૂટે ન જે કદી ધર્મથી, તે પાસ ધર્મ તજાવતા.  
 શ્રદ્ધા પ્રેમવધવાને બદલે, દિન દિન ઓછા કરાવતા;  
 મહાપુરુષો ધર્મ જોડે, તે જીવનો તે ડગાવતા.  
 સાચા હીરા કદી હથોડાના, ધાવથી તૂટતા નથી;  
 તોમસાચા ભક્તા કદીએ, ધર્મથી તૂટતા નથી.  
 માટે તજી ગુમાન સધળા, ધર્મની ભાવના કરો;  
 “વલ્લભ”ની આશિષથી, સત્ય પદે સૌ સંચરો.

---○---

૧૪

**શિષ્ય :** હાલ જગતમાં વાઇવિલાસ અનહદ વધી ગયો છે. તેથી ધર્મ અને અધર્મ એક જેવા લાગે છે; માટે શું કરવું?

**ગુરુદેવ :** ધર્મ એક પ્રભુ તરફ જવાનો માર્ગ છે અને તેની પ્રાપ્તિના સિદ્ધાંતો જે જેના અનુભવમાં આવે તે અનુભવ પ્રમાણે જણાવે છે. ધાર્ણાએ મહાપુરુષોએ ટૂંકા અને સફળ માર્ગ શોધી કાઢ્યા છે. ત્યારે કેટલાક શંકાઓ કરે છે કે :- આ હકીકત અમુક ધાર્મિક પુસ્તકોમાં લખેલી નથી પણ ત્યાં વિચારવાનું છે કે જેમવિજ્ઞાનવેત્તાઓ વિજ્ઞાનના જ્ઞાનમાં આગળ વધે તેમનથી હકીકતો બતાવતા જાય છે, જેમજેમનવી શોધો અને ઉપયોગો ખોળતા જાય છે તેમજ જેને જે હકીકત હાથ લાગે તે જણાવે છે અને આ રીતે કુદકે ને ભુસ્કે વિજ્ઞાનની શોધ આગળ વધતી જાય છે; તે પ્રમાણે આધ્યાત્મિક જ્ઞાન, ધર્મજ્ઞાન, યોગજ્ઞાનમાં પણ વધુ સંશોધન (શોધખોળ) દ્વારા સત્ય, ટૂંકા અને સરળમાર્ગ હાથ લાગતા જાય છે અને તેથી ફેરફાર થતા જાય છે; પરંતુ તેની પાછળ સત્ય, ધર્મ, સદાચાર અને પ્રભુપ્રાપ્તિનું મુળ ધ્યેય કાયમરહેલું હોય છે, તેમાં પરિવર્તન (ફેરફાર) થયેલું હોતું નથી.

(વધુ આવતાં અંકે)



## ૨૦૧૫ના વર્ષ માટે ચેતવણી લવાજમ ભરવા બાબતે સૂચના

આથી ચેતવણી માસિકના દરેક ગ્રાહક ભાઈ-બહેનોને જણાવવામાં આવે છે કે ચેતવણી માસિક ૨૦૧૫ના વર્ષ માટેનું લવાજમ લેવાનું ચાલુ હોવાથી દરેક ગ્રાહક ભાઈ-બહેનોએ પોતાનું લવાજમ નિયુક્ત પ્રતિનિધિઓને ત્યાં સમયસર ભરાવી દેવું.

**(લવાજમ ભરવાની છેલ્લી તા. ૩૧-૧૨-૨૦૧૪)**

**લવાજમ મનીઓર્ડરથી મોકલવાનું એઝ્રેસ :-**

ચેતવણી કાર્યાલય, શ્રીવલ્લભવાડી, રામબાગ, મણીનગર, અમદાવાદ-૮.

**વાર્ષિક લવાજમરા. ૬૦/- તથા આજુવન લવાજમ રા. ૧૫૦૦/-**

### **લવાજમ સ્વીકારવા અંગો નિયુક્ત કરેલ પ્રતિનિધિઓ :-**

- |                                                                                                                    |                                                                                                                    |
|--------------------------------------------------------------------------------------------------------------------|--------------------------------------------------------------------------------------------------------------------|
| (૧) શ્રી ઊંકારેશ્વર મંદિર,<br>દે. શ્રી વલ્લભવાડી,<br>રામબાગ, મણીનગર, અમદાવાદ-૮.                                    | (૬) શ્રી અરવિંદભાઈ સી. લાડ<br>એ-૮, દેવ્યાની એપાર્ટમેન્ટ<br>(અમ.જી રોડ) બોરીવલ્લી પૂર્વ,<br>મુંબઈ-૬૬.               |
| (૨) વલ્લભમાનવોદ્ધારક મંડળ<br>વલ્લભાશ્રમ, મુ.પો. અનાવલ,<br>તા. મહુવા, જી. સુરત.                                     | (૧૦) શ્રી છાન્કુમાર વલ્લભભાઈ મહેતા<br>દે. મોટીનેહર પાસે, મુ.પો. વાંસકુદ્ધ,<br>વાચા-કર્ચેલિયા, તા. મહુવા, જી. સુરત. |
| (૩) શ્રી ઉત્તમભાઈ જેસીંગભાઈ પટેલ<br>મુ.પો. ખટાણા, વાચા-અંબાતલાટ,<br>તા. ધરમપુર, જી. વલસાડ.                         | (૧૧) શ્રી છીતુભાઈ ખુશાલભાઈ પટેલ<br>દે. રામબાગ સોસાયટી,<br>અસ્તાન રોડ, મુ.પો. બારડોલી, જી. સુરત.                    |
| (૪) શ્રી બાબુભાઈ ઉક્કડભાઈ નાયક<br>દે. પટેલ ફળિયું, મુ.પો. આછવણી,<br>તા. ચીખલી, જી. નવસારી.                         | (૧૨) શ્રી હરીશભાઈ મગાનભાઈ પટેલ<br>મુ.પો. અટગામ, તા. જી. વલસાડ.                                                     |
| (૫) શ્રી મગાનભાઈ આર. કંઠોળિયા<br>પ્રાથમિક શાળા, મુ.પો. શામગાંધીન,<br>તા. આહવા, જી. ડાંગ.                           | (૧૩) શ્રી પ્રતાપભાઈ કુંવરભાઈ રાજપુત<br>દે. વજુરફળિયા, નવી પોસ્ટની સામે,<br>મુ.પો. માંડવી, તા. માંડવી, જી. સુરત.    |
| (૬) શ્રી ઈશ્વરભાઈ સુરજુભાઈ વસાવા<br>દે. પરોઢા હાઉસની બાજુમાં,<br>મુ.પો. સોનગાઠ, જી. સુરત.                          | (૧૪) શ્રી પ્રેમભાઈ અમ. પટેલ<br>સેક્ટર-૭, જલોક નં. ૧૨૦/૨,<br>ચૌધરી સ્ક્રૂલની સામે, ગાંધીનગર.                        |
| (૭) શ્રી ભુપેન્દ્રસિંહ જશુભાઈ સોલંકી<br>મુ.પો. નરોલી, તા. સેલવાસ,<br>જી. દાદરાનગર હવેલી.                           | (૧૫) શ્રી ધનસુખભાઈ રામભાઈ પટેલ<br>દે. કૃષ્ણાકુંજ સોસાયટી, કચેરીની પાછળ,<br>તા. વાંસદા, જી. વલસાડ.                  |
| (૮) શ્રી કંચનભાઈ મંજુભાઈ પ્રજાપતિ<br>દે. પ્રજાપતિ મહોલ્લો, મુ.પો. મોટીવેડ,<br>તા. ચોરાંસી, જી. સુરત, વાચા કતારગામ. |                                                                                                                    |

ધૃટક નકલ રૂ. ૫-૦૦  
વાર્ષિક લવાજમ રૂ. ૬૦-૦૦

Chetavni (GUJ) RNI No. GUJ GUJ / 2005 / 16095  
Postal Regd. No. GAMC-1507/2012-2014 Valid up 31-Dec-2014  
Posted at Ah'd PSO On 27th of Every Month



“यत्र न सूर्यस्तपति यत्र न वायुवर्त्तति यत्र न चन्द्रमा भासति ।  
 यत्र न तक्षत्राणि भास्ति यत्रताजिन्दहेति यत्र न मृत्युप्रेविशति ।  
 यत्र न हुःभानी प्रविशास्ति सदानन्दं परमानन्दं शान्तं  
 शाश्वतं सदाशिवं ब्रह्मादि वन्दितं योगिधर्येयं परंपदं ।  
 यत्र गत्वानश्च निर्वत्तन्ते योगिनः”

અર્થ :- જ્યાં સૂર્ય પ્રકાશતો-તપતો નથી, જ્યાં વાયુ વાતો નથી, જ્યાં ચંદ્રમા દેખાતો નથી, જ્યાં તારા-નક્ષત્રો જણાતા નથી, જ્યાં અજિન બાળી શકતો નથી, જ્યાં મૃત્યુ આવી શકતું નથી, જ્યાં હુઃખો પ્રવેશી શકતાં નથી, તેવું સર્વદા આનંદસ્વરૂપ, પરમ આનંદરૂપ, પરમ શાંતિરૂપ જે કોઈ કાળે નાશ ન પામે તેવું અવિયણ, શાશ્વત, સદા પરમ કલ્યાણરૂપ બ્રહ્માદિ જેનાં વંદન ઉપાસના કરે છે તેવું યોગીઓનું જે ધ્યેય એટલે મોક્ષપ્રાપ્તિ કરવાનું પરમ લક્ષ્ય છે તેવું પરમપદ પરમેશ્વર છે કે જ્યાં ગયા પછી યોગીઓ કદાપિ સંસારમાં કદી પાછા આવી શકતા નથી. તેવું અખંડ અવિયણ, મોક્ષપદ તેજ પરમેશ્વર સ્વરૂપની પ્રાપ્તિ છે. જેને શાસ્ત્રકારો “સાયુજ્ય મુક્તિ” કહે છે, યોગીઓ “પરમધ્યેય” કહે છે.

વર્ષ-૧૦, અંક-૧૦, સંવત ૨૦૭૧ કારતક સુદ-૪, સોમવાર ૨૭-૧૦-૨૦૧૪

માલિક, મુદ્રક/પ્રકાશક અને તંત્રી	: જ્યવર્ધન રમુજીલાલ વ્યાસ વલ્લભવાડી રામબાગ, મણીનગર, અમદાવાદ-૩૮૦૦૦૮. દ્વારા તા. ૨૭-૧૦-૨૦૧૪ના રોજ પ્રસિધ્ય કર્યું.
ચેતવણી કાર્યાલય	: વલ્લભવાડી, રામબાગ, મણીનગર, અમદાવાદ-૩૮૦૦૦૮.
મુદ્રણ સ્થળ	: ભવાની ઓફિસેટ, ૩/૨૦, કેલાસ એસ્ટેટ, ઓઢવ, અમદાવાદ-૩૮૨૪૧૫.